

પ્રતિ,
તંત્રીશ્રી
દૈનિક.....

તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ વોર્ડ નં.૧૧, ૧૪, અને ૧૬માં પાંચમાં તબક્કાનો
સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

સેવાસેતુ કાર્યક્રમમાં હોમ્યોપેથીક ડૉ.મેઘાણી દ્વારા નિશુલ્ક ડેન્ચ્યુની અટકાયતી
દવા આપવામાં આવેલ.

સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોના ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નો સ્થળ ઉપર જ નિકાલ
કરવામાં આવેલ.



રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહિવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓનુ ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ આયોજન કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચમા તબક્કાના સેવાસેતુમાં તા. ૦૬/૧૨/૨૦૧૯, શુક્રવારના રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૧મા મહિલા એક્ટીવીટી સેન્ટર, નાનામવા ખાતે યોજાયો. જેમાં મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર ધનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ

હરસોડા, વોર્ડ પ્રભારી અધિનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, વોર્ડ મહામંત્રી હરસુખભાઈ માકડીયા, સંજયભાઈ બોરીયા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

ઈસ્ટ ઝોન વોર્ડ નં.૧૬, રંગીલા હનુમાન મંદિર, વિવેકાનંદ નગર ખાતે યોજાયો. જેમાં, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય શ્રી અરવીંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાહોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર હાઝનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, વોર્ડ પ્રભારી જીણાભાઈ ચાવડા, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા, વોર્ડ મહામંત્રી જીતુભાઈ સિસોદીયા, જતીનભાઈ પટેલ, અગ્રણીશ્રી સુરેશભાઈ વસોયા, પ્રવિણભાઈ ક્રિયાડા, નરેન્દ્રભાઈ ડવ, પઠભા ખાયર, પૂર્વ મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૪, કામદાર કલ્યાણ મંડળ, કોઠારીયા કોલોની ખાતે યોજાયો. જેમાં, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ઇંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, વોર્ડ પ્રભારી નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવાસેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરેલ.

સેવાસેતુ કાર્યક્રમમાં હોમ્યોપેથીક ડૉ.મેઘાણી સાહેબની ટીમ દ્વારા નિશુલ્ક ડેન્ચ્યુંની અટકાયતી દવા આપવામાં આવેલ.

પાંચમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૧માં કુલ ૮૨૯ અરજીઓ, વોર્ડ નં.૧૪માં કુલ ૮૪૭ અરજીઓ તથા વોર્ડ નં.૧૬માં કુલ ૮૮૬ અરજી તેમજ અન્ય સેવાની કુલ ૯૪૩ અરજીઓ આવેલ, જેમાં મુખ્યત્વે આધારકાર્ડ, વાત્સલ્યકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વિગેરે માટે અરજીઓ આવેલ. તે તમામ અરજીઓનો નિકાલ થયેલ.

(પી. એ. ટુ મેયર)

